



REGD. OFFICE : SF-206, Silver Oak Complex, B.P.C. Road, Vadodara - 390 020.  
CORP. OFFICE : #3B, Patanwala Compound, Opp. Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar (West), Mumbai - 400 086. India.  
Tel. : +91-22-2500 5245, 2500 8208, 2500 5246. • Fax : +91-22-2500 4893. • E-mail : accounts@corallab.com • Website : www.corallab.com  
CIN NO. L24231GJ1997PL C031669

04<sup>th</sup> February, 2021

To,  
The Manager,  
BSE Limited  
Corporate Relations Department,  
1st Floor, New Trading Ring,  
P.J. Towers, Dalal Street,  
Mumbai- 400 001.

REF : SCRIP CODE NO.524506

Dear Sir/Madam,

**Subject: Compliance under Regulation 30 & 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations 2015**

Pursuant to Regulation 30 & 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of Notice of Board Meeting to be held on 11<sup>th</sup> February, 2021 to consider and approve unaudited financial results of the quarter and nine months ended 31<sup>st</sup> December, 2020 published in following newspapers:-

1. Business Standard (English) (04.02.2021)
2. Western Times (Gujrati) (04.02.2021)
3. Western Times (English) (04.02.2021)

This is for your information and records.

Thanking you and assuring you of our best co-operation at all times.

Yours sincerely,

For CORAL LABORATORIES LIMITED,

RUCHI ANJARIA  
COMPANY SECRETARY & COMPLIANCE OFFICER



Encl.: as above

**BAMBINO AGRO INDUSTRIES LIMITED**  
 CIN No: L15440TG1983PLC004363; 4E, Surya Towers, S.P. Road, Secunderabad-500 003.  
 Ph No: 040-44363322, Email id: cs@bambinoagro.com

**NOTICE**

NOTICE is hereby given pursuant to Regulation 29 of SEBI (LODR) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on **Saturday the 13th February, 2021**, to inter alia consider and take on record the **Un-Audited Financial Results for the quarter & nine months ended 31st December, 2020.**

For **BAMBINO AGRO INDUSTRIES LIMITED**  
**MYADAM SHIRISHA**  
 Managing Director  
 DIN: 07906214

Place : Secunderabad  
 Dated: 03-02-2021

**CORAL LABORATORIES LIMITED**  
 Registered Office: SF-206, Silver Oak Complex, BPC Road, Vadodara - GJ 390020  
 Corp Office: 3/B Patanwala Compound, Opp. Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai - 400 086.  
 Tel: 022-2500 5245  
 Email: cs@corallab.com  
 Website: www.corallab.com  
 CIN: L24231G1997PLC031669

**NOTICE**

Pursuant to Regulation 29(1) and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that the meeting of Board of Directors of the Company is scheduled to be held on Thursday, 11th February, 2021 at 3.00 PM at the Corporate Office of Company at 3/B, Patanwala Compound, Next To Fitness World, L.B.S. Marg, Ghatkopar (W) Mumbai-400086 for considering and adopting:

- Unaudited Financial Results of the Company for the Quarter and Nine months Ended 31st December, 2020 and Limited Review Report thereon in terms of Regulation 33 of Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- Any other business with the permission of chairman.

The Copy of the notice is also available at the website of the Company at [www.corallab.com](http://www.corallab.com) and that of BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com).

For **Coral Laboratories Limited**,  
**Ruchi Anjaria**  
 Company Secretary  
 & Compliance Officer

PLACE: Mumbai  
 DATE: 03rd February, 2021

**CMS FINVEST LIMITED**  
 Regd. Office :10 Princep Street, 2nd Floor, Kolkata - 700072  
 Einfo@cmsinfotech.com  
 W: www.cmsinfotech.com  
 Ph.: 91-33-4002280, Fax: 91-33-22379053  
 CIN:L67120WB1991PLC052782

**NOTICE**

Notice is hereby given pursuant to Regulation 29 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on Wednesday, 10th February, 2021 at 1.30 P.M., inter alia, consider and approve unaudited financial results for quarter ended on 31st December, 2020. The Notice is also available on the Company's website at [www.cmsinfotech.com](http://www.cmsinfotech.com) and on the Stock Exchange website at [www.cse-india.com](http://www.cse-india.com). Further, in accordance with the Code of Conduct for Prohibition of Insider Trading, the trading window had been closed w.e.f., 1st January, 2021 and will remain closed till 48 hours after the conclusion of the board meeting.

By order of the Board  
 For CMS Finvest Limited  
 Sd/ Surendra Kumar Jain  
 Date : 02.02.2021  
 Place : Kolkata  
 DIN: 00166852

**ICICI Bank** Branch Office: ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007

**PUBLIC NOTICE - TENDER CUM AUCTION FOR SALE OF SECURED ASSET**  
 (See proviso to rule 8(6))  
**Notice for sale of immovable assets**

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" as per the brief particulars given hereunder;

Sr. No.	Name of Borrower(s) / Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of Auction
1.	Anita Arvind Vaktharia (Borrower) Arvind Kumar Vaktharia (Co-Borrower) LBBRD00001884165	Office No. 105 and 106, 1st Floor, Billi Patra Complex, Mouje- Savad, R.S. No. 384/1 Paik 3, Harni/Varasia Ring Road, Vadodara- 390006. Built up area 986 Sq. Ft.- Free Hold Property.	Rs. 17,42,214/- (as on January 31, 2021)	Rs. 40,05,000/- Rs. 4,00,500/-	February 15, 2021 From 11:00 AM To 01:00 PM	February 26, 2021 From 12:00 PM Onwards
2.	Priyanshu K Choksi (Borrower)/ Kunal K Choksi (Co-Borrower) LBBRD00002915058 LBBRD00002915059	Flat No. J 104, 1st Floor, Shree Siddeshwar Homes, Opp. Shree High View, New VIP Road, Sayajipur, Vadodara- 390019. Built up area of 56.74 Sq. Mtr.- Free Hold Property	Rs. 30,92,535/- (as on January 31, 2021)	Rs. 15,00,000/- Rs. 1,50,000/-	February 15, 2021 From 01:30 PM To 03:00 PM	February 26, 2021 From 01:00 PM Onwards
3.	Jagdish V Pujari (Borrower) LBBRD00002054968	Flat No. 302, 3rd Floor, Pramukh Swami, Ding Dong Chokdi, TP 13, ChhaniJakat Naka, Chhani, Vadodara- 391740. Built up area 37.68 Sq. Mtr.- Free Hold Property.	Rs. 20,26,742/- (as on January 31, 2021)	Rs. 8,51,000/- Rs. 85,100/-	February 15, 2021 From 03:30 PM To 05:00 PM	February 26, 2021 From 2:00 PM Onwards

The online auction will be conducted on website (URL Link- <https://disposalhub.com>) of our auction agency M/s NexXen Solutions Private Limited. The Mortgagors/ noticee are given a last chance to pay the total dues with further interest till **February 25, 2021 before 04:00 PM** else these secured assets will be sold as per schedule.

The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at **ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007** and thereafter they need to submit their offer through the above mentioned website only on or before **February 25, 2021 before 02:00 PM** along with scan image of Bank acknowledged DD towards proof of payment of EMD. Kindly note, in case prospective bidder(s) are unable to submit their offer through the website then signed copy of tender documents may be submitted at **ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007** on or before **February 25, 2021 before 04:00 PM** Earnest Money Deposit DD/PO should be from a Nationalised/ Scheduled Bank in favour of "ICICI Bank Limited" payable at Vadodara.

For any further clarifications with regards to inspection, terms and conditions of the auction or submission of tenders, kindly contact **ICICI Bank Limited** on 7304914237/ 7573024297 or M/s NexXen Solutions Private Limited on 9710029933/ 9810029926/ 0124423933.

Please note that Marketing agencies **1. M/s NexXen Solutions Private Limited** **2. Augeo Assets Management Private Limited** have also been engaged for facilitating the sale of this property.

The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons.

For detailed terms and conditions of the sale, please visit [www.icicibank.com/n4p4](http://www.icicibank.com/n4p4)  
 Date: **February 04, 2021**  
 Place: **Vadodara**

Authorized Officer  
 ICICI Bank Limited

**ODISHA GRAMYA BANK**  
 INFORMATION TECHNOLOGY DEPARTMENT  
 HEAD OFFICE, GANDAMUNDA, PO: KHANDAGIRI, BHUBANESWAR

Bids are invited from prospective bidders for RFP to select service integrator for deployment of active directory along with procurement of hardware, software and support services in Odisha Gramya Bank.

For details visit Bank's website: [www.odishabank.in](http://www.odishabank.in)

RFP ref# **OGB/RFP/ITD/AD/008/2020-21** dated **04th February 2021**  
**Last Date & Time of Submission of Bid: 25th February 2021, 15:00 Hours**  
 Address for Contact: IT Department, Odisha Gramya Bank, Head Office, Gandamunda, Bhubaneswar-751030  
 General Manager IT

**TIDEL PARK LTD**  
 (An ISO 9001/14001 Company)  
 No.4, Rajiv Gandhi Salai, Taramani, Chennai 600 113  
 Ph: 044-2254 0500/501; Fax: 2254 1744

Notification No. HR/1/2021

TIDEL Park Ltd., invites applications through email only from eligible candidates for the post of "COMPANY SECRETARY" on Fixed Term Contract Basis for a period of One year extendable for up to another Two years. For complete details, please visit the website [www.tidelpark.com](http://www.tidelpark.com).

Last date for receipt of applications is 14.02.2021, 5.00 p.m.  
 MANAGING DIRECTOR

**VIDHI SPECIALTY FOOD INGREDIENTS LIMITED**  
 [CIN: L24110MH1994PLC076156]  
 Registered Office: E/27, Commerce Center 78, Tardeo Road, Mumbai-400034  
 Phone No.: 022-6140 6666; Fax No.: 022- 23521980  
 Website: [www.vidhifoodcolour.com](http://www.vidhifoodcolour.com); Email id: [mitesh.manek@vidhifoodcolour.com](mailto:mitesh.manek@vidhifoodcolour.com)

**NOTICE**

NOTICE is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that the meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Tuesday, February 09, 2021 at 11:30 a.m.** at the Registered Office of the Company, inter-alia, to consider and approve, the Un-audited Financial Results (Standalone and Consolidated) of the Company for the third quarter and nine months ended December 31, 2020 as prescribed under regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Further pursuant to the SEBI (Prohibition of Insider Trading) Regulation, 2015, as amended from time to time, the trading window of the Company has been closed from January 01, 2021 and shall remain closed till 48 hours from the announcement of the Un-audited Financial results of the Company for the third quarter and nine months ended December 31, 2020 on Tuesday, February 09, 2021.

The said notice may be accessed on the Company's website at [www.vidhifoodcolour.com](http://www.vidhifoodcolour.com) and also on the website of the Stock Exchanges at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) where the shares of the Company are listed.

For Vidhi Specialty Food Ingredients Limited,  
**Sd/-**  
**Awdhesh Kumar Pandey**  
 Company Secretary and Compliance Officer

Place: Mumbai  
 Date: February 03, 2021  
 Membership No.: A60501

**Tube Investments of India Limited**  
 CIN:L35100TN2008PLC069496  
 Regd. Office: 'Dare House', 234, N.S.C. Bose Road, Chennai - 600 001  
 Tel: 91 44 4217770-5 Fax: 91 44 4210404  
 Website: [www.tiindia.com](http://www.tiindia.com)  
 E-mail id: [investorservices@tiimurugappa.com](mailto:investorservices@tiimurugappa.com)

**NOTICE**

Notice is hereby given pursuant to Regulations 29 and 47(1)(a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors will be held on **Thursday, 11th February, 2021** to consider among other matters, the unaudited financial results of the Company for the quarter and nine months ended 31st December, 2020.

This information is also available on the websites of the Company [www.tiindia.com](http://www.tiindia.com), National Stock Exchange of India Ltd [www.nseindia.com](http://www.nseindia.com) and BSE Ltd [www.bseindia.com](http://www.bseindia.com).

For Tube Investments of India Limited  
**S SURESH**  
 Chennai  
 3rd February, 2021  
 Company Secretary

**ATN INTERNATIONAL LTD.**  
 Regd. Office :10 Princep Street, 2nd Floor, Kolkata - 700072  
 Einfo@atninternational.co.in  
 W: www.atninternational.co.in  
 Phone :91-33-4002280, Fax:91-33-22379053  
 CIN:L65993WB1983PLC080793

**NOTICE**

Notice is hereby given pursuant to Regulation 29 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on Friday, 12th February, 2021 at 4.30 P.M., inter alia, consider and approve unaudited financial results for quarter ended on 31st December, 2020. This Notice is also available on the Company's website at [www.atninternational.co.in](http://www.atninternational.co.in) and on the Stock Exchanges website at [www.nseindia.com](http://www.nseindia.com), [www.bseindia.com](http://www.bseindia.com) and [www.cse-india.com](http://www.cse-india.com). Further, in accordance with the Code of Conduct for Prohibition of Insider Trading, the trading window had been closed w.e.f., 1st January, 2021 and will remain closed till 48 hours after the conclusion of the board meeting.

By order of the Board  
 For ATN International Limited  
 Sd/- Santosh Kumar Jain  
 Date : 02.02.2021  
 Managing Director  
 Place : Kolkata  
 DIN : 00174235

**Elgi Rubber Company Limited**  
 Registered Office: 2000, Trichy Road  
 Coimbatore - 641005  
 +91(422)4321000; info@elgirubber.com;  
 www.elgirubber.com  
 CIN: L25119T22006PLC013144

**NOTICE**

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, the 11th February, 2021 at Coimbatore, inter-alia, to consider among other matters, unaudited financial results of the Company for the quarter and nine months ended 31st December, 2020.

The above notice is available on the company's website [www.elgirubber.com](http://www.elgirubber.com) and also on the website of Stock Exchange [www.nseindia.com](http://www.nseindia.com).

For Elgi Rubber Company Limited  
**V. Santhanakrishnan**  
 Coimbatore  
 03.02.2021  
 Company Secretary

**DEBTS RECOVERY TRIBUNAL-II**  
 Government of India, Ministry of Finance  
 3rd Floor, Bhikhubhai Chambers, Near Kochrab Ashram, Paldi, Ahmedabad, Gujarat.

FORM No.22 (Earlier 62) [Regulation 36 & 37 of DRT Regulations, 2015] [See Rule 52 (1) (2) of the Second Schedule to the Income Tax Act, 1961] READ WITH THE RECOVERY OF DEBTS AND BANKRUPTCY ACT, 1993

**E- AUCTION/SALE NOTICE**  
**THROUGH REGD.AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM/PUBLICATION**

**RP/RC No. 248/2017** **OA No. 847/2016**

**CERTIFICATE HOLDER BANK / FI : STATE BANK OF INDIA**  
**VS.**  
**CERTIFICATE DEBTORS : M/S. Venus Lifestyle Ltd (in Liq.) & Ors.**

To  
**CD No.1. : M/s. Venus Lifestyle Ltd. (in Liquidation)**  
**Official Liquidator:** 3rd Floor, Corporate Bhavan, Behind Zydus Hospital, S. G. Highway Road, Thaltej, Ahmedabad - 380 059

Since the aforesaid CDs have failed to pay an amount of Rs.163,02,37,450.79 in terms of judgment and decree dated 08.05.2017 passed in OA No.847/2016, as per my order dated 27.01.2021 under the mentioned properties will be sold by public e-auction in the aforementioned matter. The auction sale will be held through "online e-auction" Website: <https://www.drt.auctiontiger.net>

Lot No	Description of the properties	Reserve Price (rounded off)	EMD 10% (rounded off)
01	(a) <b>INDUSTRIAL LAND &amp; BUILDING</b> All that piece and parcel of land and building bearing Plot No. C/1/B/452, C/1/B/453, C/1/B/454, C/1/B/455 & C/1/B/456 admeasuring about 3611.20 Sq. Mtrs i.e., 38870.95 Sq. Fts with lease hold rights in the land/plots and super structure thereon at Sachin Industrial Area of GIDC situated on the land bearing Block No. 553/Paikee, 563/paikee & 388/paikee at village Talanpur, 7 Gabheni, Taluka Choryasi, District Surat, Gujarat. + (plus) (b) <b>PLANT &amp; MACHINERIES</b> 6 Dying Machine (Damage), 3 Yarn Heating Machine (damage), Dying Plant Set, 18 Dispenser Tank PVC, 2 Dispenser Tank SS, 2 Color Dispenser PVC, 3 FRP Tank, 6 Preparation Machine, 2 Pressure Valve (Min. 2 Bar & Max. 3 Bar), 1 Electromekanik Make Machine, MS Platform, 2MS Storage Tank, 1 EOT Crane, 3 Ton Cap/25 life, 1 Humidation Plant (damage), 3 Steam Boiler with fans, Bag Filters, Cyclone & Chimney 120 Ht., Utility RO Plant (Damage), 2 Good Lift.	Rs. 607.00 Lacs	Rs. 61.00 Lacs
(a) + (b)		Composite Reserve Price** Rs. 697.00 Lacs	Composite Earnest Money Rs. 70.00 Lacs
02	<b>Plant &amp; Machineries</b> 6 Dying Machine (Damage), 3 Yarn Heating Machine (damage), Dying Plant Set, 18 Dispenser Tank PVC, 2 Dispenser Tank SS, 2 Color Dispenser PVC, 3 FRP Tank, 6 Preparation Machine, 2 Pressure Valve (Min. 2 Bar & Max. 3 Bar), 1 Electromekanik Make Machine, MS Platform, 2MS Storage Tank, 1 EOT Crane, 3 Ton Cap/25 life, 1 Humidation Plant (damage), 3 Steam Boiler with fans, Bag Filters, Cyclone & Chimney 120 Ht., Utility RO Plant (Damage), 2 Good Lift.	Rs. 90.00 Lacs	Rs. 9.00 Lacs

\*Note 1: The prospective buyers to note that all the properties are under physical possession of the DRT/Bank.  
 \*\*Note: It may be noted that in case of bids are received for both Lot No. 1 & 2 above, the preference and priority will be given to bidders bidding for Lot No.1. Lot No.2 will be sold separately in case of no bids for Lot No.1. It may also be noted that separate reserve price and separate EMD is indicative only and properties will be sold out on composite reserve price by paying composite EMD.

**Notes : In case of any claims, the priority of payment will be decided in terms of Section 31-B of RDB Act, 1993. EMD shall be deposited by through RTGS/NEFT as per schedule given below in the account as per details as under:**

Beneficiary Bank Name	State Bank of India, Commercial Branch
Beneficiary Name	SBI SAMB AHMEDABAD RECOVERY ACCOUNT
Beneficiary Account No.	31666015329
Branch Address	Commercial Branch, Ahmedabad
IFSC Code	SBIN0006926

**PIMPRI CHINCHWAD MUNICIPAL CORPORATION**  
**CIVIL ENGINEERING DEPARTMENT**  
**TENDER NOTICE No. - CIVIL/HO/82/02/2020-2021**

Offers by way of e-tendering (Percentage) are invited by the City Engineer, Pimpri Chinchwad Municipal Corporation from contractors in e-tendering system for following works.

- The contractor shall quote his Percentage offer on the Cost of work excluding Royalty and material testing charges as mentioned below.
- The offer for work shall be exclusive of GST. The GST at the applicable rate shall be paid separately by PCMC for work
- Regarding the Royalty, the policy that the corporation determines will be binding on you.

Sr. No	Name of work	Estimated cost put to the Tender (Rs) (+/-)	Cost of Work excluding Royalty and Material testing charges (Rs)	Royalty (Rs)	Testing Charges (Rs)	Earnest money (Rs)	Security Deposit (Rs)	Time limit in calendar Months	Cost of Tender Document + With GST (Non Refundable) (Rs.)
1	Providing & Constructing Remaining work at Shahu Shrushti back side of Shahu Maharaj Statue at Ward No - 10	72,870,523	72,805,272	739,307	65,250	364,353	3,643,530	24	22,523
2	Construction of Raining Work OF Reservation No.371 B Pimple Saudagar	8,136,909	8,109,508	184,285	27,400	81,369	406,850	12	3,147

**Time table for the tenders shall be as follows:**

Online sale of tenders	Date: 4/02/2021 to Date: 17/02/2021
Last date of submission of tenders	Date: 17 /02/2021 up to 3.00 pm
Pre Bid Meeting Date & Time	Date: 9 /02/2021 at 3.00 pm
SR NO 1 Place of Pre Bid Meeting	Office of City Engineer, 1st Floor, PCMC Main Building Pimpri, Pune 411018
Date of opening of tenders	Date: 18 /02/2021 at 3.00 pm (if possible)

The Municipal Commissioner PCMC reserves the right to accept or reject any tender partially or completely without any reason thereof. The details of above works, such as Security Deposit, Earnest Money Deposit, Terms & Conditions of the Tender and Schedule of works, are available on web site [www.pcmcindia.gov.in](http://www.pcmcindia.gov.in), <http://mahatenders.gov.in>. In case of any technical problem related to the tender document, the same can be referred to the NIC email support at [eproc@nic.in](mailto:eproc@nic.in) or on telephone numbers 0120-4200462, 0120-4001002, 0120-4001005, 0120-627787.

ADVT No. 728  
 No: ENGG/TEN/GARDEN/ 32/2021  
 Date :- 3 /02/2021

**sd/-**  
**City Engineer**  
 Pimpri Chinchwad Municipal Corporation,  
 Pimpri - 411 018.

**REL**  
**REVATHI EQUIPMENT LIMITED**  
 Regd. Office : Pollachi Road, Malumachampatti, Coimbatore - 641 050.  
 CIN No: L29120T21977PLC000780  
 Phone No. 0422-6655100, 0422 - 6655111  
 E-Mail : [compliance.officer@revathi.in](mailto:compliance.officer@revathi.in)  
 Website: [www.revathi.in](http://www.revathi.in)

**NOTICE**

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Friday, the 12th February, 2021, inter-alia to consider and approve the unaudited financial results for the quarter and nine months ended 31st December, 2020.

The said notice may be accessed on the Company's website at [www.revathi.in](http://www.revathi.in) and the intimation of such notice is also available on the stock exchange websites at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com).

For Revathi Equipment Limited  
**K. MAHESWARAN**  
 Coimbatore  
 03.02.2021  
 Company Secretary & Compliance Officer

**National Peroxide Limited**  
 CIN: L24299MH1954PLC009254  
 Registered Office: Neville House, J. N. Heredia Marg, Ballard Estate, Mumbai - 400001  
 Head Office: C-1, Wadia International Centre, P. Budhkar Marg, Worli, Mumbai - 400025  
 Tel: 022-66620000 • Website: [www.naperol.com](http://www.naperol.com) • Email: [secretarial@naperol.com](mailto:secretarial@naperol.com)

**EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS (STANDALONE AND CONSOLIDATED) FOR THE QUARTER AND NINE MONTH ENDED DECEMBER 31, 2020**

Sr. No.	Particulars	Standalone						Consolidated					
		Quarter Ended		Nine Months Ended		Quarter Ended		Nine Months Ended		Quarter Ended		Nine Months Ended	
		31.12.2020	30.09.2020	31.12.2019	30.09.2019	31.12.2020	30.09.2020	31.12.2019	30.09.2019	31.12.2020	30.09.2020	31.12.2019	30.09.2019
1	Total Income from Operations	6,651.04	15,033.08	3,175.38	6,651.27	15,085.63	3,176.54						
2	Net Profit for the period (before Tax, Exceptional and Extraordinary Items)	1,222.09	2,261.27	(769.76)	1,222.05	2,311.14	(768.93)						
3	Net Profit for the period before Tax (after Exceptional and Extraordinary Items)	1,222.09	2,261.27	(769.76)	1,222.05	2,311.14	(768.93)						
4	Net Profit for the period after Tax (after Exceptional and Extraordinary Items)	900.31	2,917.65	(553.75)	900.29	2,954.89	(553.49)						
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,098.26	16,057.81	(2,605.99)	921.29	40,414.58	(6,705.68)						
6	Paid Up Equity Share Capital (face value of ₹10/- each)	574.70	574.70	574.70	574.70	574.70	574.70						
7	Earnings per share (before and after extraordinary items) (face value of ₹ 10/- each) (Not annualised)												
	(a) Basic	15.67	50.77	(9.64)	15.67	51.42	(9.63)						
	(b) Diluted	15.67	50.77	(9.64)	15.67	51.42	(9.63)						

**Notes:**

- The above is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter and Nine months ended December 31, 2020 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of these results are available on the Stock Exchange's website ([www.bseindia.com](http://www.bseindia.com)) and the Company's website ([www.naperol.com](http://www.naperol.com)).
- The said results have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on February 2, 2021 and February 3, 2021 respectively.

For **National Peroxide Limited**  
**Sd/-**  
**(Rajiv Arora)**  
 Chief Executive Officer & Director  
 DIN: 08730235

Place : Mumbai  
 Date : February 3, 2021

**WABAG**  
 sustainable solutions. for a better life.  
**VA TECH WABAG LIMITED**  
 CIN : L45205TN1995PLC030231  
 Regd. Office: "WABAG HOUSE", No.17, 200 Feet Thoraipakkam-Pallavaram Main Road, Sunnambu Kolathur, Chennai 600 117, Tamil Nadu, India  
 Phone : +91 44 6123 2323 Fax : +91 44-6123 2324  
 Website: [www.wabag.com](http://www.wabag.com) | Email: [companysecretary@wabag.in](mailto:companysecretary@wabag.in)

**NOTICE**

Notice is hereby given in compliance with the provisions of Regulation 47 (1) of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on **Thursday, the 11th February 2021**, to inter alia, consider, approve and take on record, the unaudited financial results (both standalone and consolidated) of the Company for the quarter ended 31st December 2020.

This information is also available on Company's website at [www.wabag.com](http://www.wabag.com) and on Stock Exchanges' website at [www.nseindia.com](http://www.nseindia.com) and [www.bseindia.com](http://www.bseindia.com).

By order of the Board  
 For VA TECH WABAG LIMITED  
**Sd/-**  
**R.Swaminathan**  
 Place : Chennai  
 Date : 3rd February 2021  
 Company Secretary & Compliance Officer

**NARBADA GEMS AND JEWELLERY LIMITED**  
 CIN: L01222GT1992PLC014173  
 Reg. Office: 3-6-291/4/B, 2nd Floor, Hyderabad, Hyderabad- 500029. Ph:040-48506411  
 Website: [www.narbadajewellery.com](http://www.narbadajewellery.com); E-mail: [consec@narbadajewellery.com](mailto:consec@narbadajewellery.com)

**NOTICE**

Pursuant to Regulation 29 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, 11th February, 2021, at 3-6-291/4/B, 2nd Floor, Hyderabad, Hyderabad- 500029, inter-alia, to consider and approve the Un-Audited Financial Results for the Quarter ended on 31st December, 2020. For further details, refer to the Company's website: [www.narbadajewellery](http://www.narbadajewellery.com)



## Novel injection to treat skin cancer

**New York,** Researchers are developing a skin cancer treatment that involves injecting nanoparticles into the tumour, killing cancer cells with a two-pronged approach, as a potential alternative to surgery.

The results, published in the journal Proceedings of the National Academy of Sciences, indicates that an injection-based therapy would also mean that patients could have multiple tumours treated in a single visit.

According to the researchers, for the treatment, tumours are injected with polymer-based nanoparticles carrying a chemotherapy agent.

Key to the treatment's

success is that the nanoparticles are bioadhesive — that is, they bind to the tumours and remain attached long enough to kill a significant number of the cancer cells, the researchers said.

"When you inject our nanoparticles into a tumour, it turns out that they've remained within that tumour very well," said co-author Mark Saltzman from the Yale University. "They accumulate and bind to the tumour matrix, so one single injection lasts for a very long time — the particles stay there and slowly release the compounds. You need that to get rid of the lesion," Saltzman added.

For comparison, the same drug was injected

freely into tumours of control models without the nanoparticles.

They found that the tumours were significantly more diminished when the drugs were delivered by nanoparticles.

Also critical to the therapy is that the treatment can be combined with an agent that stimulates the body's immune system, the team said. In many cases, getting rid of tumours with an injection could eliminate the need for surgery, the researchers said.

It may also then avoid potential wound infections and other complications. Additionally, some patients with other medical conditions are poor candidates for surgery.

## 3 in 4 Indian professionals to look for new job in 2021: LinkedIn

**New Delhi,** More than three in four professionals in India will consider changing jobs or actively look for a new role in the next 12 months, said a new survey by professional networking platform LinkedIn on Wednesday.

But the new "Job Seeker" research also revealed a sense of professional uncertainty and worry among Indian professionals as the job market continues to get more competitive in 2021.

More than one-third of job seekers in India are worried about too many recruitment stages and extensively long application documents, while three in four

professionals say they have reservations about networking.

Despite this uncertainty, India remains resilient towards career growth as two in three professionals say they are confident about their future progression while two in five think attending networking events, and investing in online learning will be critical to landing a job in 2021.

The findings are based on 1,016 survey responses. As job seekers continue to navigate the uncertainties of the job market today, LinkedIn launched the 2021 'Jobs on the Rise' India list to empower professionals with critical insights about the dynamic jobs landscape, especially those who may have lost their jobs during the pandemic.

The top career opportunities as per the Jobs on the Rise 2021 India list include freelance content creators, social media and digital marketing roles, marketing roles, business development and sales roles, and specialised engineering roles, among others.

Other top opportunities include finance roles, education roles, artificial intelligence roles, e-commerce roles, cybersecurity roles,

data science roles, healthcare roles, human resources roles, user experience designer roles, and customer service roles.

"This year's Jobs on the Rise India list is a reflection of how the work ecosystem and the jobs market rapidly changed in 2020. Digital transformation has continued to drive all industries, and both, tech and non-tech roles have shifted to meet the needs of a new collaborative, remote work culture.

"The list shows us that audience builders and content creators are key to brands, HR continues to be at the heart of all operations, user and customer experience are critical in the new online world of service, and emerging tech, especially ed-tech, continues to boom," Ruchee Anand, Director, Talent & Learning Solutions, India at LinkedIn, said in a statement.

Top job trends based on the list include brands and individuals engaging audiences online, cybersecurity becoming critical to a digital-first future, Covid-19 accelerating emerging tech solutions, customer experience becoming key, and lifelong learning emerging as key to keeping talent ahead of the curve.

## Business Brief

### Sensex surges 600 points to claim new highs

**Mumbai,** The euphoric post-budget rally continued in the Indian stock market on Wednesday as the BSE Sensex surged over 600 points to trade above the 50,400 level. It has touched an all-time high of 50,432.28 points. Around 12.55 p.m., Sensex was trading at 50,416.62, higher by 618.90 points or 1.24 per cent from its previous close of 49,797.72.

It opened at 50,231.06 and has touched an intraday low of 49,515.88 points. The Nifty on the National Stock Exchange too is well on its course to touch 15,000 and recorded a new high of 14,845.45 points on Wednesday.

Around 12.55 p.m., it was trading at 14,838.20, higher by 190.35 points or 1.3 per cent from its previous close. Healthy buying was witnessed in healthcare, IT and auto stocks among others.

IndusInd Bank, Power Grid and Sun Pharmaceutical were the top gainers on the Sensex so far, while Maruti Suzuki, ITC and Ultratech Cement were the major losers.

### Future Retail files appeal in Delhi HC

**New Delhi,** Future Retail has filed an appeal in the Delhi High Court against the impugned order dated February 2 passed by a single judge, the company said in a filing. Future Retail moved the court against status quo order on the deal with Reliance and the hearing will take place on Thursday.

Bar and Bench reported that a division bench of Chief Justice D.N. Patel and Justice Jyoti Singh said that the matter would be heard on Thursday. Mentioning the filing of the appeal, senior advocate Darius Khambata for Future Retail Ltd urged the bench to hear their stay application on Wednesday afternoon itself. "FRL will be saved from insolvency...the matter is coming up tomorrow otherwise," Khambata said as per the report. Senior advocate Rajiv Nayyar for Amazon, opposed the mentioning and stated that the court's procedure ought to be followed.

### RBI releases circular on risk-based internal audit for NBFCs, UCBS

**Mumbai,** The Reserve Bank of India (RBI) on Wednesday released a circular on risk-based internal audit (RBIA) for non-banking finance companies (NBFC) and urban co-operative banks (UCB).

The circular covers all deposit taking and non-deposit taking NBFCs, including Core Investment Companies, with asset size of Rs 5,000 crore and above, and all Primary (Urban) Co-operative Banks (UCBs) with asset size of Rs 500 crore and above.

It intends, to provide the essential requirements for a robust internal audit function, which include sufficient authority, stature, independence, resources and professional competence, so as to align these requirements in larger NBFCs, UCBS with those stipulated for scheduled commercial banks, said an RBI statement. "It is expected that the adoption of RBIA by such entities would help to enhance the quality and effectiveness of their internal audit system," it said.

### Impasse over as Oppn agrees to discuss Prez address

**New Delhi,** The opposition on Wednesday agreed to discuss the Motion of Thanks on Presidential Speech after it was unanimously agreed upon that its duration would be increased to 15 hours, giving opportunity for the farm laws to be discussed, as was being demanded by several parties.

On Tuesday, there was a ruckus in the Upper House as Opposition did not let it function after its suspension notice was rejected by Rajya Sabha Chairman M. Venkaiah Naidu.

As the proceedings began for the day on Wednesday, Leader of Opposition Ghulam Nabi Azad said: "The government has cited that there is no ritual of discussing anything before the president motion of thanks so all the opposition has agreed to discuss the thanks motion and take up the farmers issue then." The Chairman after the proposal of the Parliamentary Affairs Minister Pralhad Joshi agreed on the broad consensus in the House.

### Three AAP members named by Chair for causing disruption

**New Delhi,** The Rajya Sabha Chairman M. Venkaiah Naidu on Wednesday named three Aam Aadmi Party (AAP) members — Sanjay Singh, N.D. Gupta and Aushil Gupta — for causing disruption in the proceeding of the House.

The Chairman exercising the powers named the three MPs and asked them to withdraw from the House as other political parties agreed to discuss the farm laws in the motion of thanks of the President.

The AAP members forced adjournment for a short period and the House reassembled at 9.40 a.m. Earlier the opposition agreed to discuss the motion of thanks prior to the discussion on contentious farm laws and it was decided to increase the time of the discussion unanimously.

Leader of opposition Ghulam Nabi Azad said, "The government has cited that there is no ritual of discussing anything before the motion of thanks so all the opposition agreed to discuss the thanks motion and take up the farmers issue later."

The Chairman after the proposal of the Parliamentary Affairs Minister Pralhad Joshi agreed on the broad consensus in the House and also gave nod to increase the timing of the discussion to 15 hours to discuss farm laws.

### Over Rs 124 cr spent to promote tourism in 2017-20: Centre

**New Delhi,** The Centre informed the Rajya Sabha on Wednesday that more than Rs 124 crore was spent in the last three years on media campaigns for tourism promotion in the country.

The information was given through a reply by Union Minister of State for Tourism (Independent Charge) Pralhad Singh Patel to a written question by Biju Janata Dal (BJD) MPs Bhaskar Rao Nekkanti and Prashanta Nanda.

Patel said that different media campaigns are conducted by the Ministry of Tourism to promote domestic tourism in India. In the last three years, campaigns in the print media, television, online, radio, theatre and SMSes were run.

Patel said Rs 25,70,95,135 was spent in 2017-18, Rs 65,25,12,193 in 2018-19 and Rs 33,27,44,370 in 2019-20. Thus, in last three years, Rs 1,24,23,51,698 was spent on media campaigns related to tourism.

The Minister said that media plans are received by the Ministry of Tourism through the Bureau of Outreach and Communication, Doordarshan, and National Film Development Corporation. This campaign is run for all the states of India and not any particular state. — IANS

## Farmers' protests at Delhi borders causing inconvenience to residents: Government

**New Delhi,** The ongoing farmers' agitation has been causing inconvenience to the residents of the national capital as well as neighbouring states, the government told Parliament on Wednesday.

Replying to an unstarred question, Union Minister of State for Home G. Kishan Reddy said the information was shared with the Centre by the Delhi Police as Ghazipur, Chilla, Tikri and Singhu borders of the national capital have been blocked by the agitating farmers.

He further said "in any

agitation there is financial loss incurred by people and governments".

Thousands of farmers, mainly from Punjab and Haryana, have been protesting on these Delhi borders of the capital since November 26, seeking withdrawal of the three contentious farm laws enacted in September last year.

The agitation led to barricaded roads, creating traffic snarls in several areas of the city with commuters being diverted from many points.

On Wednesday, traffic jams were reported from

the eastern, southern and central parts of the city as the situation worsened because of the closure of the Ghazipur border, Delhi-Meerut expressway, NH-9 and NH-24. The closure of almost all the lanes of NH-24 has resulted in bumper-to-bumper traffic on roads in the eastern parts of the city.

The Ghazipur border remains fully closed. Traffic has been diverted from NH-24, NH-9, Road no 56, 57 A, Kondli, Paper Market, Telco T point, EDM Mall, Akshardham and other areas. Traffic was also heavy on

Vikas Marg, IP extension and NH 24.

Security has been beefed up across Delhi after the violence on Republic Day during the tractor rally by farmers who went on a rampage at Red Fort where they also hoisted a farmers' union flag and a religious flag.

The violent incidents led to serious injuries to over 300 police personnel and the death of a farmer. The Delhi Police have registered more than 44 cases and arrested 122 people so far in connection with the violence.

## RS to start discussion on motion of thanks on Wednesday

**New Delhi,** The Rajya Sabha was adjourned on Tuesday amid the opposition's demand for a discussion on the farm laws and their withdrawal. On Wednesday, the Upper House is scheduled to discuss the motion of thanks to the President.

"Bhubhneswar Kalita to move an address to be presented to the President in the following terms: That the Members of the Rajya Sabha assembled in this session are deeply grateful to the President for the address which he was pleased to deliver to both the Houses of the Parliament on January 29, 2021," read the bulletin of the Rajya Sabha business list.

The opposition on Tuesday forced the Upper House to be adjourned after the House witnessed sloganeering the moment it assembled a day after the Union Budget was presented in the Parliament.

Rajya Sabha Chairman M. Venkaiah Naidu rejected a suspension notice given by the opposition on the farm laws. The rejection did not go down well with the opposition parties with their members raising slogans before the Chairman's podium.

Parliamentary Affairs Minister Pralhad Joshi said: "The opposition should adhere to the Chairman's decision."

Naidu said: "The ongoing dialogue between the agitating farmers and the government can be discussed during the motion of thanks to the President on Wednesday."

The suspension notice was given by Manoj Jha of Rashtriya Janata Dal, Ghulam Nabi Azad of Congress, T. Shiva of DMK, Ashok Siddarth of Bahujan Samaj Party and E. Kareem of CPI-M. The opposition gave the notice under Rule 267 of the Rajya Sabha. Leader of Opposition Ghulam Nabi Azad said: "The farmers have been agitating for months now. The matter is serious and should be discussed."

— IANS

## Yogi hits MSME target with Rs 62,000 cr loan disbursement

**Lucknow,** The Yogi Adityanath government has achieved its target in distributing loans to units and generating a substantial number of employment under Mission Rozgar. Additional Chief Secretary, MSME Navneet Sehgal said, "Loans worth Rs 62,000 crore have been distributed to MSME units of the state during the period from April 1, 2020 to December 31, 2020, not only achieving the target three months ahead of time but surpassing many sectors in the process." Buoyed by the achievement, the target has been revised upwardly to Rs 76,000 crore for the current fiscal year.

He further said, "The credit to MSME units helped them continue with their activities even during the trying times of the pandemic and generated additional employment of 30 lakh. By the end of current financial year, the total employment through MSME units is likely to cross 80

lakh-mark."

The MSME sector, comprised about 90 lakh units, Uttar Pradesh accounts for about 14 per cent of the units in the country.

Chief Minister Yogi Adityanath has projected it as the growth engine of the economy of the state in terms of industrial activities and generation of employment.

The state government has put due emphasis on MSME sector, one component which (ODOP) has already been a success story.

In this regard, the state government has recently launched the 'Udyam Sarathi' App which has provided a platform to entrepreneurs to access all information about self-employment and related activities to set up their businesses.

The app, prepared under the ODOP scheme and considered to be a master-key for exploring self-employment opportunities to the youth, would easily be able to get a varied range.

## Instagram tests disabling ability to share post to stories

**San Francisco,** Facebook-owned photo-sharing platform Instagram is conducting a test which stops some users from sharing feed posts within their Stories.

The new experiment is to see how it changes engagement with the popular feature.

The company announced the change in a notification banner sent to users in "select countries" where the test is being conducted, The Verge reported on late Tuesday.

"We hear from our community that they want to see fewer posts in Stories. During this test, you won't be able to add a feed post to your Story," the notification reads.

Resharing posts to stories is a fairly common practice, though it does create situations where you'll see a post in your

feed and then immediately see that post duplicated in your friend's stories, the report said.

Taking away the ability to reshare is responding to a behaviour Facebook and Instagram encouraged in the first place by placing stories so prominently in the app and offering the ability to share them, it added.

For now, disabling resharing remains a test, much like the changes to likes the company considered and the variety of new app layouts it has prototyped.

Twitter is also currently testing the ability to share tweets to Instagram stories as stickers.

**CHANGE OF NAME**  
I have changed my minor daughter name from **DEVANSI JAIN** to new name **DEVANSHI JAIN**  
Add.: 67, Basant Bahar-1, Bopal, Ahmedabad 3138

**CHANGE OF NAME**  
I have changed my name from **PATEL SHAILESHKUMAR CHANDULAL** to new name **PATEL SHAILESHBHAI CHANDULAL**  
Add.: D-64, Harsiddhsmriti Society, Nr. Navsarjan School Ranip, Ahmedabad-380011 3141A

**CHANGE OF NAME**  
I have changed my name from **MOAMAD FARUK ABDULRAJAK KELAWALA** to new name **UMER FARUK ABDULRAJAK KELAWALA**  
Add.: 1448, Gajipir Kumbharvad Jamalpur, Ahmedabad-380001 3142

**CHANGE OF NAME**  
I have changed my name from **GAJJAR PRAVINKUMAR DALSUHKRAM** to new name **GAJJAR PRAVINBHAI DALSUHKRAM**  
Add.: Ranip, Ahmedabad 3139A

**PUBLIC NOTICE**  
Our Company **UNICON INDUSTRIES**  
Plot No. 3363, Phase 4, GIDC, Chhatral, Gandhinagar, vide Letter No. SEIAA/GUJ/JEC/5(11)961/2020 got environment clearance by SEIAA on Dt. 27/08/2020. Copy of EC letter is available with the Gujarat Pollution Control Board, and may also be seen at website of SEIAA, Gujarat at [www.seiaa.gujarat.gov.in](http://www.seiaa.gujarat.gov.in)

**CORAL LABORATORIES LIMITED**  
Registered Office: SF-206, Silver Oak Complex, BPC Road, Vadodara - GJ 390020  
Corp Office: 3/B Patanwala Compound, Opp. Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai - 400 086.  
Tel: 022-2500 5245  
Email: [cs@corallab.com](mailto:cs@corallab.com)  
Website: [www.corallab.com](http://www.corallab.com)  
CIN: L24231GJ1997PLC031669

**WESTERN RAILWAY-RAJKOT DIVISION**  
**TENDER FOR OUTSOURCING OF MAINTENANCE OF THE PSI ASSETS**  
Tender Notice No.: DRM/RJT/E-Tender/TRD/2020-2021/02R (EL), Dt. 28.01.2021 (1) Tender No.: DRM/RJT-EL-TRD-2020-21-02R (2) Name of Work: Outsourcing of maintenance of the PSI assets of Viramgam-Surenranagar, Surendranagar-Dhrangadhra, Rajkot-Khamthaliya, Wankaner/TSS sections for a period of 24 months. (3) Approximate Cost: ₹ 1,40,02,299.14/- (4) EMD: NIL (5) Date & time to apply online: on 26.02.2021 upto 15.00 hours. (6) Address of the Office: Divisional Railway Manager (Electrical/TRD), Western Railway, Kothi Compound, Rajkot- 360001. Website particulars: [www.irps.gov.in](http://www.irps.gov.in) RJT-105  
Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

**CHANGE OF NAME**  
I have changed my name from **SAIYED PATHAN MUSEB SHAH MEHBOOB SHAH** to new name **SAIYED MUSEB SHAH**  
Add.: 1197/1, Jansahabgali, Laldarwaja, Ahmedabad 3139

**CHANGE OF NAME**  
I have changed my name from **KALPESHKUMAR BACHUBHAI PATEL** to new name **KALPESH BACHUBHAI PATEL**  
Add.: 7, Shreeji Nagar, Part-2, (Maheshwari) Nr. Navsarjan School Ranip, Ahmedabad-382480 3141

**WESTERN RAILWAY - RAJKOT DIVISION**  
**CORRIGENDUM**  
Corrigendum to Tender Notice No. DRM/RJT/E-Tender/TRD/2020-2021/07R (EL) Dt.26.01.2021. Name of Work: Rajkot Division: Providing of various types of traction bonds. EMD will be Rs. NIL/- instead of Rs. 38,400/- (Bid Security Declaration as per Railway Board's letter No. 2020/CE-I/CT/3E/GCC/Policy dated: 30.12.2020 to be submitted in lieu of Bid Security/ Earnest Money Deposit) RJT-106  
Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

**WESTERN RAILWAY - RAJKOT DIVISION**  
**CORRIGENDUM**  
Corrigendum to Tender Notice No. DRM/RJT/E-Tender/TRD/2020-2021/06R (EL) Dt.26.01.2021. Name of Work: Providing of different types of traction bonds in Rajkot Division. EMD will be Rs. NIL/- instead of Rs. 54,400/- (Bid Security Declaration as per Railway Board's letter No. 2020/CE-I/CT/3E/GCC/Policy dated: 30.12.2020 to be submitted in lieu of Bid Security/ Earnest Money Deposit) RJT-107  
Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

**NOTICE**  
Pursuant to Regulation 29(1) and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations 2015, Notice is hereby given that the meeting of Board of Directors of the Company is scheduled to be held on Thursday, 11th February, 2021 at 3.00 PM at the Corporate Office of Company at 3 B, Patanwala Compound, Next To Fitness World, L.B.S. Marg, Ghatkopar (W) Mumbai- 400086 for considering and adopting:

- Unaudited Financial Results of the Company for the Quarter and Nine months ended 31st December, 2020 and Limited Review Report thereon in terms of Regulation 33 of Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- Any other business with the permission of chairman.

The Copy of the notice is also available at the website of the Company at [www.corallab.com](http://www.corallab.com) and that of BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com).

For Coral Laboratories Limited, Sd/- Ruchi Nandani Company Secretary & Compliance Officer  
PLACED: Mumbai DATE: 03rd February, 2021

**WESTERN RAILWAY-AHMEDABAD**  
**VARIOUS CONSTRUCTION WORKS IN CONNECTION WITH DOUBLING PROJECT**  
E-Tender No. Dy.CE(CII)-VG-SIOB-51: (1) Name of work with its location: Miscellaneous leftover works related area, approach road, protection works, duty burk at L.Cs, fencing etc. between stations Dhanala and Maliya Myana in connection with Viramgam-Samakhiali Doubling project on Ahmedabad Division of Western Railway. (2) Completion Period: 06 (Six) months including Monsoon (2) Approx. Cost of Work: ₹ 554.01 lakhs (3) EMD: ₹ 4,27,000/- (4) Closing date & time for submission of bid/Revised bid and Opening of E-Tender: Up to 15.00 hours on 19-02-2021 and Any Time after 15:30 hours on 19-02-2021. (5) Website particulars Notice board location where complete details of tender can be seen & address of the office: Complete details of tender including eligibility criteria are available on Western Railway website [www.irps.gov.in](http://www.irps.gov.in). Office of Deputy Chief Engineer (C II, (W.R.), Nr. Shahar Kotda Police Station, Saraspur, Railwaypura, Ahmedabad-380002. In case of any clarification the firm may contact at the above office during the working hours or person or at office Telephone No. 079-22925498. CPM-046  
Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

**GUJARAT CONTAINERS LIMITED**  
CIN: L28120GJ1992PLC017081  
Regd. Office: Plot no. 488, Baroda - Savli Highway, VIII. Tunday, Tal. Savli, Dist. Vadodara - 391 775, Tel. (2667) 262084, 262220  
Email: [cs@gujaratcontainers.com](mailto:cs@gujaratcontainers.com) Website: [www.gujaratcontainers.com](http://www.gujaratcontainers.com)

**NOTICE**  
Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that the Meeting of the Board of Directors of the Company is scheduled to be held on Friday, the 12<sup>th</sup> February, 2021 at 4.30 p.m. onwards at its Corporate Office at 201-202, Alkapuri Arcade, "B" Wing, R.C. Dutt Road, Opp. Welcome Hotel, Vadodara - 390 007, to consider inter alia, the Unaudited Quarterly Financial Results of the Company for the 3<sup>rd</sup> Quarter ended 31<sup>st</sup> December, 2020. This information is also available on the Company's website [www.gujaratcontainers.com](http://www.gujaratcontainers.com) and BSE website [www.bseindia.com](http://www.bseindia.com).

Date : 02-02-2021  
Place : Vadodara  
For Gujarat Containers Limited  
Sd/- Narendra D. Shah  
Company Secretary & Compliance officer

**Surbhi Industries Limited**  
CIN NO. L17110GJ1992PLC017672  
Regd.off : "SURBHI HOUSE", 2nd Floor, F.P. No. 206, Bh Old Sub-Jail, Ring Road, Khatodara, SURAT GUJARAT 395002

**NOTICE**  
Pursuant to Regulation 47 read with Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on **09th day of February 2021, at 12.30 PM** at Registered office of the company inter alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the quarter ended 31st December 2020. Further, details are also available on Company's website [www.surbhi.com](http://www.surbhi.com) as well as Stock Exchange's website [www.bseindia.com](http://www.bseindia.com).

By order of the Board  
For, SURBHI INDUSTRIES LTD.  
Sd/-  
RAVJIBHAI PARBATBHAI PATEL  
Managing Director  
(DIN: 00023332)

Place : Surat  
Date : 03.02.2021

**ROLCON ENGINEERING COMPANY LTD.**  
CIN: L29259GJ1961PLC001439  
Reg. Office: Anand- Sojitra Road, Vallabh Vidyanagar-388120 (Gujarat)  
E-mail: [rolcon@rolconengineering.com](mailto:rolcon@rolconengineering.com), web: [www.rolconengineering.com](http://www.rolconengineering.com)

**NOTICE**  
Notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Friday, February 12, 2021 at 4:30 p.m. at Registered office of the Company, to inter alia, to consider, take on record and approve the Standalone Unaudited Financial Result of the Company for the quarter ended on December 31, 2020, along with other agenda, if any

For, ROLCON ENGINEERING CO. LTD.  
Sd/- Ashish S. Amin  
(Managing Director)  
(DIN: 01130354)

Place : Vallabh Vidyanagar  
Date : February 03, 2021